

જિલ્લા પંચાયત પંચમહાલ—ગોધરા (દબાણ)

માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની કલમ—૪(૧)(ખ) મુજબ ૧૭ મુદ્દાઓની માહિતી. (Pro-Active Disclosure)

(તા.૩૧/૭/૧૮ની સ્થિતિએ અઘતન કરાયેલ)

મુદ્દા નં. ૧

જાહેર સત્તા મંડળનું વ્યવસ્થાતંત્ર, કાર્ય અને ફરજો

૧ જાહેરતંત્રનો ઉદ્દેશ / હેતુ :-

અરજદારની અરજીઓ પરત્વેની ગ્રામપંચાયતની ગૌચર અને પંચાયતોને સંપ્રાપ્ત ગામતળના દબાણ દુર કરવા બાબત.

૨ જાહેર તંત્રનું મિશન /દુરંદેશીપણું (વિઝન):-

માહિતીના અધિકાર અધિનિયમ-૨૦૦૫ કાયદાનો વ્યવસ્થિત અમલ થાય અને નાગરિકો તેનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી.

૩ જાહેરતંત્રનો ટૂંકો ઇતિહાસઅને તેની રચનાનો સંદર્ભ:-

- ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૧૦૫ ની જાગવાઈ મુજબ અનધિકૃત દબાણો દુર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની રહે છે. અત્રેથી દબાણ દુર કરાવવાની કામગીરી અંગેનો અહેવાલ મોકલવામાં આવે છે.
- ભારત સરકારે આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫(માહિતીનો અધિકારઅધિનિયમ-૨૦૦૫) નું જાહેરનામુ તા.૧૫/૬/૨૦૦૫થી પ્રસિધ્ધ કર્યા મુજબકાયદાનોઅમલ જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય ૧૨૦ દિવસમાં કરવાનો રહેતો હતો આથી રાજ્યમાંતા.૧૨/૧૦/૨૦૦૫થી આર.ટી.આઈ.એક્ટનો અમલ થતો હોઈ,તેના અમલીકરણની વ્યવસ્થા ઉભી કરવા તા. ૭-૯-૨૦૦૫થીઆર.ટી.આઈ.સેલ ઉભું કરવામાં આવેલ છે.

૪જાહેરતંત્રની ફરજો:-

- ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૧૦૫ની જોગવાઈ મુજબ અનઅધિકૃત દબાણો દુક કરવાની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા ગ્રામ પંચાયતની રહે છે. તેની યોગ્ય દેખરેખ તથા સૂચનાઓ આપવી.
- આર.ટી.આઈ. એક્ટના અમલ સંબંધિત નિયમો અંગે માર્ગદર્શન,સુધારણા,રાજ્યમાહિતી આયોગ સંબંધિત મહેકમ અને અન્યકામગીરી, તેમજ ભારત સરકાર સાથે આ કાયદાના સંદર્ભમાં સંપર્કકરવો.

૫ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો :-

- : દર માસે દબાણની વિગતોતથા દબાણ દુર કરવા સંબંધે ગ્રામ પંચાયતને ઠરાવ કરવામાં આવે તથા દબાણ રજીસ્ટર અદ્યતન નિભાવવુ.
- :દરેક ગ્રામ પંચાયત કક્ષાએ દબાણ રજીસ્ટર રાખવામાં આવે છે. તે સંબંધે તાલુકા/જિલ્લા કક્ષાના તમામ ફેરણી અધિકારીશ્રી ધ્વારા દબાણ રજીસ્ટરની ચકાસણી થાય છે.
- :દર માસે દબાણ દુર કરવા અંગેનું નિયત નમૂનાનું પત્રક અત્રેને બિનચૂક મહિનાની ૭ મી તારીખ સુધીમાં મળે તેવી વ્યવસ્થા કરવી.

- (૧) આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫ સંબંધિત નિયમો ઘડવા, આસબંધીસૂચનો મળે તેપરત્વેની વિચારણાકરવામાટેજોરજણાયેનિયમોમાં વધુસુધારા-વધારાકરવાબાબતોઅંગે
- (૨) રાજ્ય માહિતી આયોગનું મહેકમ, બજેટ તેમજ તેઓની કચેરીની અન્ય આનુષંગિક કામગીરી મુખ્યમાહિતી કમિશ્નરશ્રીની નિમણૂક, અને તે પછીની આનુષંગિક કામગીરી.
- (૩) આર.ટી.આઈ.એક્ટ સંબંધિત અન્ય વિભાગોના પદ્ધતિ પરત્વે માર્ગદર્શન આપવુ(૪) આ કાયદા સંબંધિત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાંરહેવુ
- (૫)

આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫નોરાજ્યમાવ્યવસ્થિતઅમલથાયતેમાટેવ્યવહારુતંત્રનીરચનાતેમજ આ બાબતે રાજ્ય માહિતી આયોગને જરૂરી મદદ પૂરી પાડવી.

- (૬) આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫ના અમલ અંગેતેમજ તેના નિયમો અંગેનું માર્ગદર્શન તેમજરાજ્ય માહિતી આયોગની રચના અને મહેકમબાબત.

- (૭) જાહેર તંત્રના રાજ્ય, નિયામક કચેરી, પ્રદેશ, જિલ્લો, બ્લોક વગેરે સ્તરોએ સંસ્થાગત માળખાનોઆલેખNil

(૮) જાહેરતંત્રની અસરકારતા અને કાર્યક્ષમતાવધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ

(૯) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અનેપદ્ધતિઓ.

(૧૦) સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેરફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર:-
નીલ

- (૧૧) મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્યકચેરીઓના સરનામાં (વપરાશકારને સમજવામાંસરળ પડે તે માટે જિલ્લા વાર વર્ગીકરણ કરો)આર.ટી.આઈ.સેલ, સામાન્ય વહીવટ વિભાગ,બ્લોક નં.૭, ૧લો માળ, સચિવાલય,ગાંધીનગર.

(૧૨) કચેરી શરૂ થવાનો સમય કચેરી બંધ થવાનો સમય જાહેર રજાઓ

:—સવારના ૧૦:૩૦ થી સાંજના૬:૧૦

:— સરકારશ્રીના પ્રસિધ્ધ કરેલ ગેઝેટ અનુસાર જાહેર રજા

કચેરીનું સરનામું :- સિવિલ લાઈન્સ ગોધરા,

જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા

મુદ્દા નં. ૨
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો.
સુચના:—શાખામાં કામ કરતાં વર્ગ—૧થી લઈ વર્ગ—૪સુધીના તમામ વિગત લખવી

૧ હોદ્દો:— ચિટનીશ ક.મ.તાલુકા વિકાસ અધિકારીશ્રી પંચ—ગોધરા

સત્તાઓ:—

દબાણ

૧.જિલ્લામાં સરકારી અને પંચાયત જમીનો પૈકી (ગૌચર) અને અન્ય પંચાયતોને સંપ્રાપ્ત જમીન પરનાદબાણ અરજી પરત્વેની કામગીરીની દેખરેખ

ફરજો:—ઉક્ત કામગીરીનું સુપરવઈઝન

—શાખાના કર્મચારીઓનું સોપેલ કામગીરીનું સુપરવઈઝન

હોદ્દો:—નાયબ ચિટનીશશ્રી (દબાણ)

—શાખાના ટેબલોની કામગીરીનું સુપરવીઝન.

મુદ્દા નં. ૩
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ.

૧. જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્યપદ્ધતિ અનુસરવામાં આવે છે.
—: સરકારશ્રીની વખતોવખતની જોગવાઈ/ઠરાવોને આધિન કામગીરી કરવામાં આવે છે.
૨. અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતિઓ / ઠરાવેલી કાર્યપદ્ધતિઓ / નિયત માપદંડો/નિયમો કયા કયા છે ? નિર્ણય લેવા માટે કયા કયા સ્તર વિચાર કરવામાં આવે છે ?
➤ સરકારશ્રીની વખતોવખતની જોગવાઈ/નિયમોને આધિન કામગીરી કરવામાં આવે છે.
૩. નિર્ણયને જનતા સુધી પહોંચાડવાની કઈ વ્યવસ્થા છે ?
—: ટપાલ વ્યવસ્થા,વર્તમાન પત્ર
૪. નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેનાં મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયા છે ?
:—ચિટનીશ કમ તાલુકા વિકાસ અધિકારીશ્રી (જ.દ)
—: નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ)
૫. નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ?
—: જિલ્લા વિકાસ અધિકારીશ્રી

મુદ્દા નં. ૪
નિયત કાર્યો બજાવવા નક્કી કરેલા ધોરણો.

(અ) સામાન્ય વહીવટ વિભાગના તા.૪/૮/૨૦૦૩ના પરિપત્ર ક્રઃ
વહસ/૧૦૦૩/મુમ/યુઓ/આર/૧૮/વસુતાપ્ર-૨ની
સૂચના મુજબ કેસોના નિકાલ માટેની સમયમર્યાદા :-

:- અત્રેથી(ગૌચર) અને અન્ય પંચાયતોને સંપ્રાપ્ત જમીન પરના દબાણ અરજી પરત્વે સંબંધિત તાલુકા વિકાસ
અધિકારી/ગ્રામ પંચાયતોની દબાણ અંગેની કાર્યવાહીની દેખરેખ.

દિવસ :- સમયમર્યાદા - નીલ

:- આરટીઆઈની એક્ટ ૨૦૦૫ મુજબ અરજી હોય તો ૩૦ દિવસમાં નિકાલ.

મુદ્દા નં. ૫
કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમ સંગ્રહ અને દફતરો

૧ જાહેર તંત્ર અથવા તેનાનિયંત્રણ હેઠળનાઅધિકારીઓ અનેકર્મચારીઓએ ઉપયોગકરવાના નિયમો,
વિનિયમો,સૂચનાઓ, નિયમ સંગ્રહ અનેદફતરોની યાદીશાખાના ઠરાવો /પરિપત્રો:

➤ સરકારશ્રીના વખતો વખતની જોગવાઈ મુજબ.

મુદ્દા નં. ૬

જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક.
અ.નં. દસ્તાવેજનીકક્ષાદસ્તાવેજનું નામઅને તેની એકલીટીમાંઓળખાણદસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ નીચેની
વ્યક્તિ પાસે છે / તેનાનિયંત્રણમાં છે.

૧સચિવાલયકક્ષાઠરાવો / પરિપત્રો/ ફાઈલો તથાપ્રકાશનોએક્ટ હેઠળના નિયમો મુજબહોય વિનંતીથી
શાખાધિકારીશ્રી/કર્મચારીશ્રી પાસે શાખામાં ઉપલબ્ધ રેકર્ડ પરથી માહિતી મેળવી શકાય છે.

હોદ્દો:-જુ.કલાર્ક(દબાણ) (ઈ.ચા)

-દબાણશાખાની વિગેરે કામગીરી

-ગૌચર અને ગ્રામપંચાયતની માલિકીની જમીનમાં થયેલ દબાણ અંગેની અરજીઓપરત્વેની
કામગીરી.

મુદ્દા નં. ૭

નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત.

નીતિ ઘડતર :

૧ શું નીતિઓના ઘડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ- પરામર્શ / સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો, નીચેના નમૂનામાં આવી નીતિની વિગતો આપો.

અ.નં.	વિષય / મુદ્દો	શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત જરૂરી છે ?	સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા.
-	-	-	-

નીતિ ઘડતર :

૨. શું નીતિઓના અમલ માટે જનતાની અથવા તેમના પ્રતિનિધિઓની સલાહ- પરામર્શ / સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો, નીચેના નમૂનામાં આવી નીતિની વિગતો આપો.

અ.નં.	વિષય / મુદ્દો	શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે ? હા / ના	જનતાની સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા.
૧	-	-	-

મુદ્દા નં. ૮

તેના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક ૧ જાહેરતંત્રને લગતા બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળો અંગેની વિગત નીચેના નમૂનામાં આપો.

<p>(૧) માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો)</p> <p>(૨) માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટૂંકો પરિચય (સંસ્થાપના વર્ષ, ઉદ્દેશ-મુખ્ય પ્રવૃત્તિઓ)</p> <p>(૩) માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર, સંચાલક, કાર્યકારી, અન્ય)</p> <p>(૪) માળખું અને સભ્ય બંધારણ</p> <p>(૫) સંસ્થાના વડા</p> <p>(૬) મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામા</p> <p>(૭) બેઠકોની સંખ્યા</p> <p>(૮) શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે ?</p> <p>(૯) શું બેઠકોની કાર્ય નોંધ તૈયાર કરવામાં આવે છે ?</p> <p>(૧૦) બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે? જો તેમ હોય તો તેમને મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.</p>	<p>NIL</p>
---	------------

મુદ્દા નં. ૯

અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી- પુસ્તિકા (ડીરેક્ટરી)

અનુ	નામ	હોદ્દો	એસટી ડી કોડ	ઈ-મેઈલ	કચેરીનું સરનામું
૧	શ્રીઆર.કે.રાજન	ના.જિ.વિ.અધિશ્રી(મ હેસુલ)	૦૨૬૭૨-૨૫૩૩૫૨	dyddop anchmahal.re v@gmail.com	જિ.પં.પંચ.ગોધરા
૨	શ્રી અંશુમન રાવલ	ચિટનીશ ક.મ. તા.વિ.અધિશ્રી(જ.દ) (ઈ.ચા)	૦૨૬૭૨-૨૫૩૩૫૨		જિ.પં.પંચ.ગોધરા
૩	શ્રી ડી.કે.ગરાસીયા	ના.ચિટનીશ(દબાણ)	૦૨૬૭૨-૨૫૩૩૫૨		જિ.પં.પંચ.ગોધરા
૪	શ્રી આર.પી. ચૌહાણ	જુ.કલાર્ક (ઈ.ચા.)	૦૨૬૭૨-૨૫૩૩૫૨		જિ.પં.પંચ.ગોધરા
૫	શ્રી કે.પી.કમવાણા	પટાવાળા	૦૨૬૭૨-૨૫૩૩૫૨		જિ.પં.પંચ.ગોધરા

મુદ્દા નં. ૧૦
વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પધ્ધતિ સહિત દરેક અધિકારી
અને
કર્મચારી મળતું માસિક મહેનતાણના વિગત.

ક્રમ	નામ	હોદ્દો	માસિક મહેનતાણ	વળતર / વળતર ભથ્થ	વિનિયમમાં જણાવ્યા મુજબ મહેનતાણું નકકી કરવાની કાર્યપધ્ધતિ.
૧	શ્રીઆર.કે.રાજન	ના.જિ.વિ.અધિશ્રી	૭૦,૬૫૦/-		
૨	શ્રી અંશુમન રાવલ	ચિટનીશ ક.મ.તા.વિઅધિશ્રી (જ.દ)	(ઈ.ચા)		
૩	શ્રી ડી.કે. ગરાસિયા	ના.ચિટનીશશ્રી	૩૧૩૪૦		
૪	શ્રી આર.પી. ચૌહાણ	જુ.કલાર્ક	(ઈ.ચા)		ફિક્સ પગાર
૪	શ્રીકે.પી.મકવાણા	પટાવાળા	૧૬,૦૨૪/-		ફિક્સ પગાર

મુદ્દા નં. ૧૧
ફાળવાયેલ અંદાજપત્ર.
તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ ચૂકવણી અંગે અહેવાલોની વિગતો-વિકાસ, નિર્માણ
અને
તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેરતંત્ર માટે.

મુદ્દા નં. ૧૨સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પધ્ધતિ.
 મુદ્દા નં. ૧૩તેણે આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિ મેળવનારની વિગતો.

ક્રમ યોજનાનું	યોજનાનું નામ / સદરું	પ્રવૃત્તિ	પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખું	પ્રવૃત્તિના અંતની અંદાજેલ તારીખ	સૂચિત રકમ	મંજૂર થયેલ રકમ	છૂટી કરેલ/ ચૂકવેલ રકમ (હપ્તાની સંખ્યા)ું	છેલ્લા વર્ષનું ખરેખર ખર્ચ	કાર્યની ગુણવત્તા માટે સંપૂર્ણપણે કામગીરી માટે જવાબદાર અધિકારી
ના	ના	ના	ના	ના	ના	ના	ના	ના	ના

મુદ્દા નં. ૧૪ વિજાણુંરૂપે ઉપલબ્ધ માહિતી.
—panchmahaldp.gujarat.gov.in

મુદ્દા નં. ૧૫ માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગતો.
—અરજી કરવાથી માહિતી મેળવી શકે છે.

૧. લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પધ્ધતિઓ અથવા સવલતો જેવી કે,

કચેરી ગ્રંથાલય	—ના
નાટક અને શો	—ના
વર્તમાન પત્રો	—ના
પ્રદર્શનો	—હા
નોટિસ બોર્ડ	—હા
કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણ	—હા
દસ્તાવેજોની નકલો મેળવવાની પધ્ધતિ માહિતીનો અધિકાર અધિનિયમ—૨૦૦૫ હેઠળ	—હા

મુદ્દા નં. ૧૬

એપેલેટ ઓથોરિટી, જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો.

અ. નં.	નામ	હોદ્દો	એસટી ડી કોડ/ ફોન નંબર	ઈ-મેઈલ	સરનામું
૧	શ્રી એ.જે.શાહ	જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અપીલ અધિકારીશ્રી	૦૨૬૭૨-૨૫૩૩૭૭	ddopanchmahal@gov.in	જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા
૨	શ્રી આર.કે.રાજન	નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જાહેર માહિતી અધિકારીશ્રી	૦૨૬૭૨-૨૫૩૩૫૨	dyddopanchmahal.rev@gmail.com	જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા

મુદ્દા નં. ૧૭

અન્ય ઉપયોગી માહિતી.

૧. લોકો ધ્વારા પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો.
૨. માહિતી મેળવવા અંગે

૧. લોકો ધ્વારા પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો.	-
અરજીપત્રક (સંદર્ભ માટે ભરેલા અરજી પત્રકની નકલ) ફી માહિતી મેળવવા માટેની અરજી કઈ રીતે કરવી કેટલીક ટિપ્પણી માહિતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તેવા વખતે નાગરિકનાઅધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી	-૨૦ આર.ટી.આઈ.એક્ટ ૨૦૦૫ની જોગવાઈઓ મુજબ નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે. -સક્ષમ સત્તાઅધિકારીશ્રીને અપીલ કરવાની રહે છે.
૨. જાહેરતંત્ર દ્વારા લોકોને અપાતી તાલીમનીબાબતમાં	
તાલીમ કાર્યક્રમનું નામ અને તેનું સંક્ષિપ્ત વર્ણન તાલીમ કાર્યક્રમ/ યોજનાની મુદ્દત તાલીમનો ઉદ્દેશ ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંકો (છેલ્લુ વર્ષ) તાલીમ માટેની પાત્રતા તાલીમ માટેની પૂર્વ જરૂરિયાતો (જો કોઈ હોય તો) નાણાકીય તેમજ અન્ય પ્રકારની સહાય (જો કોઈ હોય તો) સહાયની વિગત (નાણાકીય સહાયની રકમ જો હોય તો જણાવો) સહાય આપવાની પદ્ધતિ અરજી કરવા માટે સંપર્ક માહિતી અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પૂરી પાડવાની વિગતો જણાવો) બિડાણો / દસ્તાવેજોની યાદી બિડાણો/દસ્તાવેજોનો નમૂનો અરજી કરવાની કાર્યપદ્ધતિ પસંદગીની કાર્યપદ્ધતિ તાલીમ કાર્યક્રમનું સમયપત્રક (જો ઉપલબ્ધ હોય તો) તાલીમના સમયપત્રક સાથે તાલીમાર્થીને જાણ કરવાની પદ્ધતિ તાલીમ કાર્યક્રમ અંગે લોકોમાં જાગરૂકતા લાવવા માટે જાહેર તંત્રએ કરવાની વ્યવસ્થા જિલ્લા કક્ષા, ઘટક કક્ષા એમ વિવિધ સ્તરે તાલીમ કાર્યક્રમના હિતાધિકારીઓની યાદી	-
૪. નિયમ સંગ્રહ-૧૩ માં સમાવિષ્ટ ન કરાયેલ હોય તેવા, જાહેરતંત્રએ આપવાના પ્રમાણપત્રો, ના-વાંધા પ્રમાણપત્ર	

<p>પ્રમાણપત્ર અને ના-વાંધા પ્રમાણપત્રના નામ અને વિવરણ. અરજી કરવા માટેની પાત્રતા અરજી કરવા માટેની સંપર્ક માહિતી અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પૂરી પાડવાની વિગતો જણાવો) બિડાણો/દસ્તાવેજોની યાદી બિડાણો/દસ્તાવેજોના નમૂના અરજી કરવાની પદ્ધતિ અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા પ્રમાણપત્ર આપવામાં સામાન્યરીતે લાગતો સમય પ્રમાણપત્રનો કાયદેસરનો સમયગાળો. નવીકરણ માટેની પ્રક્રિયા (જો હોય તો)</p>	<p>-</p>
<p>૫. નોંધણી પ્રક્રિયા અંગે ઉદ્દેશ નોંધણી માટેની પાત્રતા પૂર્વ જરૂરિયાતો (જો હોય તો) અરજી કરવા માટે સંપર્ક માહિતી અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં) અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં) અરજીનો નમૂનો (અરજી કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પૂરી પાડવાની વિગતો દર્શાવો.) બિડાણો/દસ્તાવેજોની યાદી બિડાણો/દસ્તાવેજોના નમૂના અરજી કરવાની પદ્ધતિ અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા નોંધણીની કાયદેસરતાનો ગાળો (જો લાગુ પડતું હોય તો) નવીકરણ માટેની પ્રક્રિયા (જો હોય તો)</p>	<p>-</p>
<p>૬. જાહેરતંત્રે કર ઉધરાવવા અંગે વેરાનું નામ અને વિવરણ વેરો લેવાનો હેતુ કર નિર્ધારણ માટેની કાર્યવાહી અને માપદંડ મોટા કસૂરદારોની યાદી</p>	<p>-</p>
<p>૭. વિજળી/ પાણીના હંગામી અને કાયમી જોડાણો આપવા અને કાપવા અંગે જોડાણ માટેની પાત્રતા પૂર્વ જરૂરિયાતો (જો હોય તો) અરજી માટેની સંપર્ક માહિતી અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)- અન્ય ફી/ શુલ્ક (લાગુ પડતું હોય ત્યાં) અરજીનો નમૂનો (જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોય તો અરજદારે પૂરી પાડવાની વિગતો જણાવો)</p>	<p>-</p>
<p>બિડાણો/ દસ્તાવેજોની યાદી બિડાણો/ દસ્તાવેજોનો નમૂનો અરજી કરવાની પદ્ધતિ અરજી મળ્યા પછી જાહેરતંત્રમાં થનાર પ્રક્રિયા બિલમાં વાપરેલ શબ્દ પ્રયોગોનું ટૂંકું વિવરણ બિલ અથવા સેવાની બાબતમાં મુશ્કેલી હોય તો સંપર્ક</p>	<p>-</p>

માહિતી. ટેરિફ અને અન્ય ખર્ચ	
૮. જાહેરતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવનાર અન્ય સેવાઓની વિગત	